



NBK-1601010201020402 Seat No. _____

B. A. (Sem. II) (CBCS) Examination

April / May – 2017

Gujarati : Paper - IV

(ગુજરાતી વ્યાકરણ, સર્જન, લેખન કૌશલ-૨)

(*Elective-1*) (*New Course*)

(વૈકલ્પિક)

Time : **2½ Hours]**

[Total Marks : **70**

- Syllabus : (1) દરેક પ્રશ્નના ગુણ સરખા છે.
 (2) બધા પ્રશ્નો ૧૪ ગુણના છે.

૧ નીચેનામાંથી કોઈ પણ એક ગદ્યખંડનું વિવરણ કરો.

૧૪

‘વિદ્યાપીઠનું શિક્ષણ એ વિશિષ્ટ શક્તિ ધરાવનારાઓ માટેનો વિશેષાધિકાર છે અને જેમની પાસે આ શક્તિ છે પણ તે માટેના પૈસા નથી. તેમને સમાજના પૈસાથી એ તાલીમ મળવી જોઈએ. શક્તિ માટેની કસોટીમાંથી પસાર થયા વગર કોઈને વિદ્યાપીઠમાં પ્રવેશ મળવો ન જોઈએ. અને વિદ્યાપીઠમાં દાખલ થયા પણી પણ અધ્યાપકને તે વિદ્યાર્થીએ એવી ખાત્રી દેવી જોઈએ કે તે પોતાને મળેલી તક અને સમયનો પૂરેપૂરો ઉપયોગ કરે છે પોતાના અભ્યાસ અને મહેનતથી અધ્યાપકોને સંતોષ આપી શકે. તે જ વિદ્યાર્થી વિદ્યાપીઠમાં રહી શકે, તેમ થવું જોઈએ. વિદ્યાપીઠ એ નવરાશનો સમય ગાળવા માટેનું સ્થાન છે. અને ધનિક લોકોના વિદ્યાર્થીઓ એમાં ગ્રાન્ચ-ચાર વરસ લહેર કરે એવો ઘ્યાલ હવે ચાલ્યો ગયો છે. ખરુ જોતા વિદ્યાપીઠના વરસો તે વિદ્યાર્થીના વિદ્યા માટેની તપસ્યાનાં વરસો બનવા જોઈએ.’’

- બર્ટાન્ડ રસેલ

અથવા

‘કવિચિતતમાં સંચિત સંવેદનોમાંથી સ્વયંસ્કૂરણાત્મક સહજજ્ઞાન ભાવ પ્રતીકો દ્વારા અભિવ્યક્તિરૂપે પ્રગટતું હોઈ ભાવ પ્રતીકો કવિની સાધનામાં ઘણું મહત્વ ધારણ કરે છે. ઉચ્ચિત ભાવ પ્રતીકો સૂજવા ન સૂજવાં એની ઉપર કાવ્યકળાની સફળતા-નિઝળતાનો આધાર છે કાવ્યસૂચિનાં ઉધાડરૂપ ભાવ પ્રતિક સંવિશેષ મહત્વનું છે ભાવક સાથેની વ્યવહારરેખા સ્થિર બનવાનો આધાર એની જ ઉપર છે પણી અવાન્તર ગૌણ ભાવ પ્રતીકોના ઉપયોગ દ્વારા કવિના સંચિત અનુભવો કલા-કૃતિના અંશભૂત બનવા આવે છે. ખરું જોતા આખી કાવ્યરચના એ ભાવ પ્રતીકોની ભાતીગળ ગુંથણી બની રહે છે. બલ્કે વસ્તુત: આખી કૃતિ એ એક સુશ્રાવિત અખંડ ભાવ પ્રતીકરૂપે અંતર્જ્ઞાનની અભિવ્યક્તિ બની રહે છે.’’

- ઉમાશંકર જોશી

૨ નીચેનામાંથી કોઈ પણ એક ગદખંડનું સંક્ષેપીકરણ કરો :

૧૪

“આપણે એ વાત યાદ રાખવી પડશે કે અપૂર્ણતાનું ગૌરવ જ દુઃખ છે. દુઃખ એ જ અપૂર્ણતાની સંપત્તિ છે. દુઃખ જ તેની એક માત્ર મૂડી છે. માણસ જે કાંઈ સાચી વસ્તુ પામે છે, તે દુઃખ દ્વારા જ પામે છે એમાં જે તેનું મનુષ્યત્વ રહેલું છે માણસ કેવળ માગીને કશું મેળવી શકતો નથી. દુઃખ વેઠીને પામી શકે છે. બીજું જે કાંઈ ધન છે તે કાંઈ તેનું નથી. તે બધું જ વિશેશરનું છે પણ દુઃખી તો બિલકુલ તેનું પોતાનું જ છે એ દુઃખના ઐશ્વર્યને લીધે જ અપૂર્ણ જીવ પૂર્ણ સ્વરૂપની સાથે પોતાનો ગૌરવપૂર્ણ સંબંધ સાચવી રહ્યો છે. તપસ્યા દ્વારા આપણે બ્રહ્મને મેળવીએ છીએ. એ દુઃખ એ જ સાધના એ દુઃખને એ જ તપસ્યા એ દુઃખનું જ આનંદ મુક્તિ ઈશ્વર..”

- કવિવર રવિન્દ્રનાથ ઠાકુર

અથવા

“કવિ નવી ભાષા નથી ઘડતો, વ્યવહારની ભાષામાંથી જ એ નવા સંકેતો ઉપજી આવે એવો સંદર્ભ રચે છે. આ શક્તિનો પરિચય આપવો એ રસાસ્વાદની પ્રવૃત્તિનું અનિવાર્ય અંગે છે. કારણ કે એમાં જ કાર્યક્રમનો વિશેષ રહેલા છે. આપણા બધામાં રતિ, ઉત્સાહ, જુગુસા, કરુણા, નિર્વેદ વગેરે ભાવો રહેલો છે. આપણા બધામાં રતિ, ઉત્સાહ વગેરે વિશિષ્ટરૂપે સાક્ષાત્કાર કરવાની અનંત શક્યતાનો પરિચય કવિ આપણને કરાવે છે. આપણે કઈ અપેક્ષાને લઈને કવિતા પાસે જઈએ છીએ તે પણ તપાસવું જરૂરી બની રહે છે. મભ્મટ કાવ્યનાં પ્રયોજનમાં યશ શિવતંત રક્ષિત, કાન્તાની રીતે અપાતો ઉપદેશ વગેરે ગણાવે છે ખરો, છતાં કાવ્યની મીમાંસા કરતી વેળાએ પ્રાધાન્ય આપે છે. શબ્દની શક્તિને આપણે પૂરુ ગૌરવ કરતા નથી એમ જ કહેવું પડે.”

- સુરેશ જોશી

૩ નીચેનામાંથી કોઈ પણ સાત રૂઢિપ્રયોગનો અર્થ આપી, વાક્ય પ્રયોગ કરો : ૧૪

- (૧) ફોડી લેવું.
- (૨) મોહું ફેરવી લેવું.
- (૩) સડક થઈ જવું.
- (૪) નાતગતમાં પૂછાવું.
- (૫) ખડે પગે હોવું
- (૬) દેવ જાગી જવા
- (૭) હાથ મસ્તક પર હોવો.
- (૮) પગવાળીને બેસવું.
- (૯) કપાળે પરસેવો વળવો.
- (૧૦) નજર ફેરવવી.

- ૪ નીચેનામાંથી કોઈ પણ સાત કહેવતનો અર્થ આપી સમજાવો : ૧૪
- (૧) ઘર વેચીને તીરથ કરવું.
 - (૨) ચેતતા નર સદા સુખી.
 - (૩) ચોર કોટવાળને દે
 - (૪) જાગ્યા ત્યારથી સવાર
 - (૫) જેવી દસ્તિ તેવી સૃષ્ટિ
 - (૬) તેલ જૂઓ ને તેલની ધાર જૂઓ.
 - (૭) દગ્ગો કોઈનો સગો નહિ
 - (૮) દીવા પાછળ અંધારુ.
 - (૯) દોરડી બળે પણ વળ ન છોડે.
 - (૧૦) ધીરજના ફળ મીઠાં છે.
- ૫ નીચેનામાંથી કોઈ પણ સાત સમાસનો વિગ્રહ કરી ઓળખાવો : ૧૪
- (૧) શાકભાજુ
 - (૨) મા-બાપ
 - (૩) ઈશનિર્મિત
 - (૪) પ્રેમાતુર
 - (૫) દેશવાસી
 - (૬) ઘરસંસાર
 - (૭) મેધ્યાભિમાન
 - (૮) જીવનનાવ
 - (૯) ચતુર્ભૂજ
 - (૧૦) કમલનયન
-